

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટમાં ગ્રીજા કન્ફર્મડ (પાક્ષિક) COVID-19 કેસ પર સીટી ઓફિશિયલ બ્રેમ્પટનનું નિવેદન

બ્રેમ્પટન, ઓન્ટારિયો (એપ્રિલ 10, 2020) – તા. એપ્રિલ 9 નાં રોજ, સીટી ઓફિશિયલ બ્રેમ્પટનને માહિતગાર કરવામાં આવ્યું હતું કે તેની સેન્ડલવૂડ ફેસિલિટીના ટ્રાન્ઝિટ ઓપરેટરનું COVID-19 પરીક્ષણ હકારાત્મક (પોઝિટિવ) આવ્યું હતું. આ બ્રેમ્પટન ટ્રાન્ઝિટનો ગ્રીજા કન્ફર્મડ કેસ છે.

આ સમયે, સીટીની અગ્રના આ વ્યક્તિને અને તેઓના કુટુંબીજનોને સહાયતા પૂરી પાડવાની, અને અમારા કર્મચારીઓ, ગ્રાહકો અને આપણાં સમૃદ્ધાયનું આરોગ્ય અને સુરક્ષાને સંરક્ષણ પૂરું પાડવાની મદદ ચાલુ રાખવાની છે.

સીટીને જાળ થઈ એટલે નશ્ન. ૪, કર્મચારીઓ સહિત્યારી તપાસ કરવા માટે આગામી પગલાઓ નિર્ધારિત કરવા. પીલ પભિલક હેલ્થ સાથે પ્રવૃત્તમય થયા.

અસર પામેલી વ્યક્તિએ છેલ્દે એપ્રિલ 3 નાં રોજ નીચેના રૂટ્સ પર કામ કર્યું હતું:

- રૂટ 501 જુમ ક્વીન
- રૂટ 502 જુમ મેર્થન

ઉપર જણાવેલા દિવસે સમીક્ષા કરવામાં આવેલી બસો પર પ્રવાસ કર્યો હોય તેવા લોકો જે ઓને સારું લાગતું હોય, કોઈ લક્ષણો ના જણાતા હોય, તેઓએ પોતાની રોજંદી દિનર્યાર્યા ચાલુ રાખવી જોઈએ અને પભિલક હેલ્થને ફોન કોલ ના કરવો જોઈએ. જો તમને લક્ષણો વિકસે તો, કૃપા કરી પભિલક હેલ્થને કોલ કરો. જો તમને ઈમરજન્સી મેડિકલ સહાયતા જોઈતી હોય તો, કૃપા કરી 911 નંબર પર કોલ કરો. પીલ પભિલક હેલ્થ એ પણ દર્શાવે છે કે સામાન્ય સમૃદ્ધાયને હોય તેના કરતા કોઈ વધારાનું જોખમ પભિલક ટ્રાન્ઝિટ બસ પ્રવાસીઓને રહેતું નથી.

સીટી સમૃદ્ધાયને ખાતરી કરાવે છે કે તે COVID-19 નાં ફેલાવા સામે કર્મચારીઓ, ગ્રાહકો અને સમૃદ્ધાયને સંરક્ષણ આપવામાં મદદ મેળવવા દરેક જરૂરી પગલું વેવાનું ચાલુ રાખશે. વધારે સારી સક્રિએ અને સ્વચ્છતા (સેનિટાઇઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. આ સમયે, સેનિટાઇઝેશન કામગીરી દર 24 કલાકે થાય છે. સગવડો અને ટર્મિનલ લંચર્સ, ટેબલ્સ, કાઉન્ટર્સ અને ડોર હેન્ડલ્સને દિવસમાં બે વખત સાર્ક્રીન અને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે.

ઓપરેટરો અને ઉતારુઓ માટે શારીરિક અંતર જાળવવાને સહાયરૂપ થવા, નીચેના પગલાઓ અમલમાં છે:

- બસ પર ઉતારુઓની ભાર ક્ષમતા અદ્ધી બેઠકો સુધી સીમિન કરેલ છે.
- રીયર ડોર્સ (પાછળના ભાગના દરવાજાઓ) મારફતે પ્રવેશ અને ફી ફેર્સ (ભાડા ચૂકવણી વગર પ્રવાસ) અમલમાં છે. વધુમાં, મોબિલિટી ડિવાઈસીસ (ચલાયમાનતા સાધનો) ધરાવતા લોકો માટે ફુન્ટ ડોર્સ (આગળના દરવાજેથી) પ્રવેશ ચાલુ રાખ્યો છે ત્યારે, ઓપરેટરો અને ઉતારુઓ વચ્ચે જગ્યા પૂરી પાડવા પ્લાસ્ટિકની ચેદન જેવો અવરોધ મૂકવામાં આવ્યો છે.
- બહુ વ્યસ્ત રૂટ્સ પર, ઉતારુઓ બસમાં હોય તે વખતે શારીરિક અંતર જાળવવા ઉતારુઓની ક્ષમતામાં સહાયરૂપ થવા આદ્યક્ષુલેટેડ બસો મૂકવામાં આવી છે.
- બેઠકોને સાઈન બોર્ડથી ઓળખવામાં આવે છે અને ઉતારુઓને આ બેઠકો પર ન બેસવાનું કહેવામાં આવ્યું છે.

- વ્યસ્ત કામકાજના કલાકો દરમિયાન અને અઠવાડિક રજાઓમાં ઓછાં વપરાશના રૂટ્સ પર સર્વિસ રદ કરવામાં આવી છે અને શારીરિક અંતર જાળવવામાં અને ભીડ પર કાબૂ રાખવામાં સહાયતા મેળવવા સંસાધનો નવી દિશામાં સૌથી વ્યસ્ત રૂટ્સ પર વાળવામાં આવ્યા છે.

સીટીએ પીલ પણિલક હેલ્થ સાથે ઘનિષ્ઠપણે કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આ તપાસ ચાલી રહી છે ત્યારે, નવી માહિતી ઉપલબ્ધ થાય એટલે તરત માહિતી પૂરી પાડવામાં આવશે.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા થહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 બ્રવસારો છે. અમે જે કઈ કરીએ છીએ તેનો હાઈ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સક્રાણ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#)પર જોડાન. અહીં વધુ જાળકારી મેળવો www.brampton.ca.

મિલિયા સંપર્ક :

મોનિકા દુગલ (Monika Duggal)
કોઓર્ડિનેટર, મિલિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ
વ્યૂહાન્મક સંવાદ
સીટી ઓફ બ્રેમ્પટન
905-874-3426 | Monika.Duggal@brampton.ca